

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સેક્ટર-૧૦ બી
જુના, સચિવાલય પાસે ગાંધીનગર



જુન-૨૦૨૦ થી નવી માધ્યમિક /ઉચ્ચતર માધ્યમિક શાળાઓની મંજૂરી અંગે અગત્યની જાહેરાત

જુન-૨૦૨૦ થી કાયમી ધોરણે ગ્રાન્ટ નહી લેવાની શરતવાળી (નોન ગ્રાન્ટેડ) નવી બિન અનુદાનિત માધ્યમિક (ધો-૯) અને ઉચ્ચતર માધ્યમિક (ધો-૧૧) શાળાઓ (સામાન્ય પ્રવાહ અથવા વિજ્ઞાન પ્રવાહ) શરૂ કરવા સ્થાનિક રીતે રચાયેલ/ નોંધાયેલ મંડળો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

આ માટે તા.૧૦/૦૧/૨૦૨૦ ના સાંજના ૪:૦૦ વાગ્યા થી તા.૩૧/૦૩/૨૦૨૦ રાત્રિના ૧૨.૦૦ કલાક સુધી વેબસાઇટ nsa.gseb.org પર થી ઓનલાઇન અરજી પત્રક ઉપલબ્ધ રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી આવશ્યક આધારો અંગેની સૂચના ધ્યાનપૂર્વક વાંચી ઓનલાઇન અરજી સાથે જરૂરી તમામ આધાર-પુરાવાનું સ્કેનીંગ કરાવી અરજી સાથે ઓનલાઇન બિડાણ તરીકે ફરજિયાત જોડવાનું (Upload) રહેશે.

ઓનલાઇન દરખાસ્ત કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યેથી ઇ-મેલ પર મળેલા આઇ.ડી અને પાસવર્ડ મારફતે લોગીન કરીને ઓનલાઇન **SBI- E-Pay Payment system** મારફતે રૂ.૨૦,૦૦૦/- ની ફી ભરીને ઓનલાઇન દરખાસ્ત માટેની અરજી કરી શકાશે. આ દરખાસ્ત ફી કોઇ પણ સંજોગોમાં પરત મળવાપાત્ર રહેશે નહીં.

ઓનલાઇન અરજીના આધારે નવી શાળા મંજૂરી અંગે બોર્ડનો નિર્ણય શાળા મંડળ વતી ઓનલાઇન અરજી કરનાર સંચાલક મંડળને પત્ર દ્વારા જણાવવામાં આવશે.મંજૂર/નામંજૂરની વિગતો Web Site ઉપર મુકવામાં આવશે. જે શાળાને મંજૂરી મળે તે શાળા મંડળે મંજૂરીપત્રમાં જણાવેલ સમય મર્યાદામાં બાકીની રૂ ૨૦,૦૦૦/- (વીસ હજાર) રૂપિયાની રકમ બોર્ડના SBI ખાતામાં ચલણની નકલ અને અન્ય આધારો સહિતની દરખાસ્ત સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી મારફત, ઓનલાઇન ભલામણ સહિત બોર્ડની કચેરીને મળેથી શાળા નોંધણી કરવાની કાર્યવાહી કરવામાં આવશે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન શાળાની મંજૂરી માટે એક જ વખત અરજી કરી શકાશે. જેની નોંધ લેવી.બોર્ડની કચેરીમાં કોઇપણ જાતના આધારો મોકલવાના રહેશે નહીં, ફક્ત online આધારો ધ્યાને લઇ મંજૂરી આપવાની પ્રક્રિયા કરવામાં આવશે.

નોંધ:- બોર્ડની વેબસાઇટ gseb.org ઉપર નવી શાળા મંજૂરી માટેની આવશ્યક સૂચનાઓ ધ્યાને લઇ Online અરજી માટેની પ્રક્રિયા કરવાની રહેશે.

સ્થળ:- ગાંધીનગર
તા:- ૦૩/૦૧/૨૦૨૦

સહી/-
(ડી.એસ.પટેલ)
સચિવ
ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
ગાંધીનગર